



ગુજરાત જાહેર સેવા આયોગ

સરકારી પોલીટેકનીક ખાતેના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના વ્યાખ્યાતા

તથા અન્ય વિષયોના વ્યાખ્યાતાઓની ભરતી બાબતે

અગત્યની જાહેરાત

જા.ક.: ૭૨/૨૦૧૫-૧૬, સરકારી પોલીટેકનીક ખાતે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના વ્યાખ્યાતા, વર્ગ-૨ ની રૂબરૂ મુલાકાતનું આયોજન તા. ૧૯-૮-૨૦૧૭ થી ૨૪-૮-૨૦૧૭ દરમ્યાન થયેલ હતું. જેમાં Basic તથા Corresponding વિદ્યાશાખાના Meritorious ઉમેદવારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ, નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલ SCA NO. ૧૪૭૪૨/૨૦૧૭ તથા અન્ય પીટીશનોને કારણે, નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૩૧-૮-૨૦૧૭ના વચગાળાના આદેશથી સંબંધિત (Appropriate Basic Branch) વિદ્યાશાખામાં સ્નાતકની પદવી ધરાવતાં ઉમેદવારોને, સંલગ્ન (Corresponding Branch) વિદ્યાશાખાના ઉમેદવારો સામે અગ્રીમતા આપવાની રહે છે. આ Oral Order થી થયેલ Interim relief ના આદેશની યથાર્થ અમલવારી કરવા આ ભરતી પ્રક્રિયા અંતર્ગતના Appropriate Basic Branch ના Similarly Situated ઉમેદવારોને પણ લક્ષમાં લેવાના થાય છે. અને તેથી કરીને આ પ્રક્રિયામાં પ્રથમતઃ પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત Appropriate Basic Branchની પદવી ધરાવતાં ઉમેદવારોને માન્ય Corresponding Branchના ઉમેદવારોએ મેળવેલ ગુણ કે મેરિટ ક્રમાંકને અવગણીને સમાંતર અને ઇલાયદુ મેરિટ લીસ્ટ તૈયાર કરવાનું થાય છે અને આમ, અન્યથા પાત્રતા ધરાવતા અને આ કામની ભરતી પ્રક્રિયા અંતર્ગત P.T /Elimination Test કે જેમાં મુખ્યત્વે સંબંધિત વિષયના જ્ઞાનની ચકાસણી કરવામાં આવેલ તેમાં Corresponding Branch ના Meritorious ઉમેદવારોના મેરિટ ને લક્ષમાં લેવાનું થતું નથી. તદાનુસાર સંબંધિત (IT) વિદ્યાશાખાના ઉમેદવારો કે જેઓ રૂબરૂ મુલાકાતમાં બોલાવેલા Corresponding Branchના ઉમેદવારોની સાપેક્ષમાં મેરિટમાં ઉતરતા ગુણાનુક્રમ ધરાવે છે, તેઓની અરજી ચકાસણી તથા રૂબરૂ મુલાકાત ગોઠવવાનું આયોજન કરવાનું થાય છે. તેથી અગાઉ આયોજીત રૂબરૂ મુલાકાતનું પરિણામ હાલ પ્રસિધ્ધ થઈ શકે તેમ નથી..

વિશેષમાં તમામ લાગતા વળગતાને જાણ કરવાની કે આવી જ રીતે સમાન પ્રકારની અન્ય વિદ્યાશાખાની જાહેરાતોની ભરતી પ્રક્રિયા કે જેમાં P.T યોજાયેલ છે તથા ભરતી પ્રક્રિયાના અન્ય તબક્કા પ્રગતિમાં છે તેમજ જે કિસ્સાઓમાં Basic Branch અને Corresponding Branch ની બાબત લાગુ પડે છે તે અંતર્ગત પણ ઉપરોક્ત વિગતોની પરીસ્થિતિ અનુસાર અમલવારી કરવાની થાય છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તા. ૨૨/૯/૨૦૧૭